

ઓક્ટોબર 30, 2018

સીટી સત્તાવાળાઓ ગાંજો વેચતા રિટેલ સ્ટોર્સ વિશે જાહેર જનતાનું મંતવ્ય મેળવવા માટે છે ટેલિફોન સર્વે (મોજણી) અને ઓનલાઇન પબ્લિક પોલ (જાહેર મતદાન) શરૂ કરવામાં આવ્યો

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટન પોતાના રહેવાસીઓને પોતાનું મંતવ્ય જણાવવા કહી રહ્યું છે કે શું બ્રામ્પટનમાં ગાંજો વેચતા રિટેલ સ્ટોર્સ ચલાવવાની છૂટ આપવી જોઈએ કે નહીં. ગાંજો વેચતા રિટેલ સ્ટોર્સ વિશે ટેલિફોન સર્વે અને [ઓનલાઇન પબ્લિક પોલ](#) મારફતે જાહેર જનતા પાસેથી પ્રતિભાવો માગવામાં આવે છે જેથી મળેલી માહિતી નવી સીટી કાઉન્સિલને જણાવી શકાય.

ઝાંખીઓ

- સીટી સત્તાવાળાઓએ જુદી જુદી વસ્તીને આવરી લેતા 800 જેટલા બ્રામ્પટન રહેવાસીઓના કુલ નમૂનારૂપી કદમાં ટેલિફોન સર્વે હાથ ધરવા એક ત્રાહિત પેઢી, એન્વિરોનિક્સને રોકી છે. ટેલિફોન સર્વે આ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં શરૂ થશે.
- ટેલિફોન સર્વે હાથ ધરવા, એક [ઓનલાઇન પોલ](#) હવે સીટી ઓફ બ્રામ્પટનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પોલ નવેમ્બર 9, 2018 નાં રોજ રાત્રે 11:59 વાગ્યે બંધ થશે.
- ટેલિફોન સર્વે અને [ઓનલાઇન પોલ](#) બંનેના પરિણામોથી સ્ટાફ રિપોર્ટના ઘણાં ભાગોમાંનો એક ભાગ રચાશે, જે ડિસેમ્બર 5, 2018 નાં રોજ સીટી કાઉન્સિલને રજૂ કરવામાં આવશે, જેથી કાઉન્સિલને એક માહિતગાર નિર્ણય લેવામાં મદદ મળે.

રિટેલ સ્ટોર્સ સહિત, ગાંજો (કેનેબિસ) વિશે વધુ વિગતો મેળવવા, વેબસાઇટ www.brampton.ca પર [FAQs](#) વિભાગ વાંચો.

-30-

બ્રામ્પટન વિશાળ આયોજનો વિશે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રામ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | natalie.stogdill@brampton.ca